

NALIN LEASE FINANCE LIMITED

CIN: L65910GJ1990PLCO14516

NLFL/201920/BSE864

Date: -August 14, 2019

To,
The Secretary,
Bombay Stock Exchange Ltd.,
25th Floor, Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai - 400 001.

Scrip Code: - 531212

Dear Sir,

Sub: - Submission of newspaper advertisement as per Regulation 47 of SEBI (Listing obligation and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copies of the newspaper advertisements published in both the English and Gujarati edition of Western Times regarding the publication of the unaudited financial results of the company for the financial year ended 30th June, 2019.

Kindly take the above information on your records.

Thanking you.

Yours Faithfully,

For, Nalin Lease Finance Limited

Chief Financial Officer

Encl.: as above

(N.K. Patel)

Regd Office: Gandhi Nursing Home Bldg., Dr. Nalinkant Gandhi Road, HIMATNAGAR - 383 001.

Ph: (02772) 241264, 242264, Email: nalinlease@yahoo.co.in



I have changed my old name from DABHOIWALA RIZWANAFATEMA IMRAN to New Name SHAIKH **RIZVANABANU IMRAN** Add.: 4707, Khatkiwad Jamalpur, Ahmedabad

VESTERN RAILWAY-AHMEDABAD DIVISION SHIFTING/LAYING OF EXISTING PASSENGER AMENITY ITEMS AND AND INSTALLATION TESTING **COMMISSIONING CCTV CAMERAS** Tender No.: DRM-S&T-Tele(ADI)-09 of 2019-20, Name of Work: Shifting/laying of existing Passenger amenity items (Horn, Digital clock, all type cable etc.) and installation Testing Commissioning CCTV Cameras at escalators at various station in Ahmedabad Division. Estimated Cost of work:₹ 14,80,971/- (₹ Fourteen Lac Eighty Thousand Nine Hundred

Seventy One Only), EMD: ₹ 29600/-

Tender Closing and Opening Tender: Not later than 15.00 hrs of 04.09.19

and Opening on date 04.09.19 at 15.30 hrs, Website of E-Tendering:

www.ireps.gov.in Like us on: f facebook.com/WesternRly

WESTERN TIMES Disclaimer

Adverstisement appeared in this News Paper have not been verified factually and "WESTERNTIMES"

does not stand responsible for the sales proposition.

CHANGE OF NAME I have changed my old name from **RAMESHCHANDRA** JOYATARAM PATEL to New Name RAMESHBHAI JOYATARAM PATEL Add.: 43, AMARNATH VILLA, ODHAV, ${\sf AHMEDABAD}$

Slowdown Effect: Auto sector workers' seek govt intervention

New Delhi/Mumbai, Faced with the night-

marish prospect of job losses, auto sector employhave sought government's intervention through relief measures for the industry dented by truncating demand.

The employees cited that till now job losses have mainly occurred on the part manufacturers' side, however, if the current market conditions prevail then downsizing might become a reality even in the OEMs.

bile industry has been impacted the hardest by a consumption slowdown which is a culmination of several factors like high GST rates, farm distress, stagnant wages and liquidity con-

Besides, inventory pileup at the dealership level and stock management of unsold BS-IV vehicles have become a problem for the sector.

Accordingly, industry's production levels have also receded as demand plunged, eventually leading to job losses.

Industry insiders at the auto cluster of Gurugram-Manesar, home to automobile majors such as Maruti Suzuki, Hero MotoCorp and Honda Motocycle & Scooter India, say that around 50,000 to 1 lakh temporary employees across the entire value-chain, including those from ancillary industries, logistics and raw material suppliers, have been sent on unpaid leave or sacked.

However, no authentic data is currently available on the extent of job losses, as most of these have occurred on the auto part suppliers' side.

"The industry is struggling to survive. It requires

Particulars

(after Exceptional and/or Extraordinary items

Total Comprehensive Income for the period

4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items

otal Income from operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)

measures like lower GST taxes and better road networks," Kuldeep Janghu, sales. General Secretary of Maruti Udyog Kamgar Únion, told IANS in Gurugram.

"The auto industry is completely run by private sector and these companies will not be able to sustain or require the current levels of manpower, as production will fall on the back

of declining demand."

According to Satish
Kumar, an employee with a tier-I parts manufacturer to an automobile major, stable policies are required, as the ever changing physical specification of parts due to newer norms has led some vendors to shut-shop.

"These changes based on newer norms have been taken from developed countries and require heavy investments even on the side of small parts manufacturers.

Many vendors had to simply shut shop because they did not have access to those kind of resources," Kumar said. "It seems that custom-

ers have also postponed purchases and are waiting for the change in technology from BS IV to BS VI."

In addition, the employees have asked the govern-

RR METALMAKERS INDIA LIMITED (FORMERLY KNOWN AS SHREE SURGOVIND TRADELINK LIMITED)
CÎN No L51901GJ1995PLC027958
gistered Office: Office No. 501, Neel Kamal Complex, Near Hawmor Ioe Cream Parlour, Navrangpura, Ahmedabad-380009, Guje
Corporate Office: 2nd Floor, Sugar House, 93/95. Kazi Saved Street. Masiid West, Mumbai- 400 003. Maharashtra.

Unaudited Unaudited

(170.31)

(169.96

Quarters Ended Years Ended

17.7

12.2

audited Financial Results for the Quarter ended June 30, 2019 Rs. in Lakhs (Except EPS

30-Jun-2019 30-Jun-2018 31-Mar-2019 30-Jun-2019 30-Jun-2018 31-Mar-2019

Audited

110.21

83.54

ment for easier access to finance that might prop-up

"The collapse of NBFCs is a major factor for the sales downturn as these companies used to provide bulk of automobile financing," Rajesh Shukla, General Secretary of Hero MotoCorp Workers Union, told IANS.

"The government should look into the issue and create an environment where access to cheap finance is available.

Last week, automobile sector's representatives met Finance Minister Nirmala Sitharaman to apprise her of the grim situation.Recently, all major OEMs consisting of passenger, commercial, two and three wheeler manufacturers have reported a massive decline in domestic sales.

Figures from the Society of Indian Automobile Manufacturers (SIAM) showed that domestic passenger car sales in June went down by 24.07 per cent to 139,628 units. The July figures are awaited.

Consequently, sales slowdown led to curtailment of manufacturing with the domestic passenger cars' production coming down by 22.26 per cent to 169,594 units in June.

Quarters Ended

(169.64

(169.64)

(169.79

(169.79

Unaudited Unaudited Unaudited

18.87

13.0

100.83

74.3

73.1

Business Brief III

US stocks end lower

US stocks ended lower on Monday, as the market was sunk by growing worries about the prospects of US economic growth and worsening US-China trade

The Dow Jones Industrial Average fell 391.00 points, or 1.49 per cent, to 25,896.44 on Monday. The S&P 500 decreased 35.96 points, or 1.23 per cent, to 2,882.70. The Nasdaq Composite Index dropped 95.73 points, or 1.20 per cent, to 7,863.41, Xinhua reported. All of the 11 primary S&P 500 sectors traded lower

around market close, with the financials sector down over 1.9 per cent, leading the losers. Shares of Occidental Petroleum fell over 4.5 per

cent, after Evercore rated the US energy giant "inline," saying that the company's acquisition of Anadarko Petroleum caused the valuation of Occidental Petroleum to have declined.

The yields of both long-term and short-term US treasury bills plunged on Monday, with the benchmark 10-year bill's yield sliding to a bit over 1.64 per cent after market close. That widened its spread with the 3-month note's yield, which stood at nearly 1.99 per cent, thus forming an inverted curve and stoking fears of a potential recession.

Food, fertiliser, urea, petroleum subsidies touch 51% of BE

New Delhi.

Major subsidies on food, fertilisers, urea and petroleum have totalled Rs 1.51 lakh crore as on Juneend 2019, touching 51 per cent of the Budget Estimates, up from 44 per cent during same period of the

The Controller General of Accounts' (CGA) June figures show the actuals on these heads up to June end 2019 totalled Rs 1,51,824.24 crore on the Budget Estimates (BE) of Rs 2,96,684 crore. On a Corresponding Period of the Previous Year (COPPY) basis, the amount was Rs 1,16,820.17 crore (44 per cent) of the BE, whereas the current figures are 51 per cent of

ROYALE MANOR HOTELS AND INDUSTRIES LIMITED

CIN: L55100GJ1991PLC015839

Regd. Office: International Airport Circle, Ahmedabad 382475, Web: www.rmhil.com, email: royalemanorehotels@rediffmail.com, Telephone: 079-22868642/43 Telefax: 079-22868641

Extract of Standalone Unaudited Financial Results for the Quarter ended 30th June, 2019

Sr. No.	Particulars	Quarter Ended 30/06/2019 (Unaudited)	Year Ended 31/03/2019 (Audited)	Quarter Ended 30/06/2018 (Unaudited)
1	Total income from operations (net)	508.85	2393.03	456.61
2	Net Profit / (Loss) for the period (before Exceptional Item, Extraordinary items & tax)	38.46	412.68	12.59
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional Item, Extraordinary items)	38.46	412.68	12.59
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional Item, Extraordinary items)	30.46	330.35	9.99
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive			
	Income(after tax)	30.46	330.35	9.99
6	Equity Share Capital	1693.22	1693.22	1693.2
7	Reserves (excluding Revaluation	2430.80	2430.80	2100.40
	Reserve as shown in the Balance Sheet of previous year)	(as on 31.03.2019)	(as on 31.03.2019)	(as or 31.03.2018
8	Earnings Per Share (Rs. 10/-each) (not annualized)		,	
	Basic: (Rs)	0.18	1.95	0.00
	Diluted (Rs.)	0.18	1.95	0.00

Sr.

No.

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com and on company's website
- The above results were reviewed by the Audit Committee & thereafter approved by the Board of Directors at its meeting held on August 13, 2019. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.
- The Previous quarter's figures have been regrouped and/or rearranged, wherever considered necessary. By Order of the Board

For Royale Manor Hotels and Industries Limited **Ummed Singh Champawat** Place: Ahmedabad Chairman & Managing Director

AASWA TRADING AND EXPORTS LIMITED

Reg. Office: 32, Milanpark Society, Near Jawahar Chowk, Maninagar, Ahmedabad - 380 008

CIN: L51100GJ1984PLC024704 E mail: aaswaexports@yahoo.co.in Tel.No.: 079-25462907

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2019

Unaudited

Quarter ended

6/30/2019

2.80

0.37

0.37

0.30

0.30

72.00

0.04

0.04

Audited

3/31/2019

386.11

11.47

11.47

11.47

11.47

72.00

1.59

1.59

FOR AASWA TRADING AND EXPORTS LTD.

(KEYUR J. PARIKH)

CHAIRMAN

August 13, 2019

Total Income from Operations

Extraordinary items)

Extraordinary items)

Particulars

2 Net Profit/(Loss) for the period before tax and Exceptional items

4 Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or

period (after tax) and Other Comprehensive Income (after tax)]

Earnings per share [EPS] (of Rs.10/- each) (not annualised) Basic and diluted EPS before Exceptional items [in Rs.]

Basic and diluted EPS after Exceptional items (in Rs.)

Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or

Total Comprehensive Income for the period [Comprising Profit for the

DIN-00294184

Unaudited

2.62

0.32

0.32

0.24

0.24

72.00

0.03

0.03

Year ended Quarter ended

[Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] 698.5 6 Equity Share Capital leserves (excluding revaluation reserve as show 189.1 189.1 in the balance sheet) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEB (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on th Stock Exchange website i.e., www.bseindia.com and Company's webiste i.e., www.rrmetalmakers.com

The above results are in accordance with the Indian Accounting Standards(IND-AS) as prescribed under section 133 of the Companie Act, 2013, read with the relevant rules issued thereunder and other accounting principles generally accepted in India. Accordingly, previous period's figures have been reclassified / regrouped / restated wherever necessary By order of the Board of Directors For RR Metalmakers India Limited

The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held or

Mumbai, August 13, 2019

(Formerly known as Shree Surgovind Tradelink Limited Virat S Shah - Chairman, DIN-00764118

AMANI TRADING AND EXPORTS LIMITED

Regd. Office: 32, Milanpark Society, Nr. Jawahar Chowk, Maninagar, Ahmedabad - 380 008 CIN: L51100GJ1984PLC020026 E-mail: amaniexports@yahoo.co.in Tel.No.: 079-25462907 STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2019

	(Rs. In Lakhs, except per share data				
Sr.	Particulars	Unaudited	Audited	Unaudited	
No		Quarter ended 6/30/2019	Year ended 3/31/2019	Quarter ended 6/30/2018	
1	Total Income from Operations	2.73	224.31	2.74	
2	Net Profit/(Loss) for the period before tax and Exceptional items	0.24	(1.41)	(0.90)	
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.24	(1.41)	(0.90)	
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.03)	(2.45)	(1.21)	
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(0.03)	(2.45)	(1.21)	
6	Equity Share Capital	69.97	69.97	69.97	
7	Earnings per share [EPS] (of Rs.10/- each) (not annualised)				
	Basic and diluted EPS before Exceptional items [in Rs.]	(0.01)	(0.35)	(0.17)	
	Basic and diluted EPS after Exceptional items [in Rs.]	(0.01)	(0.35)	(0.17)	

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of BSE Ltd. at www.bseindia.com and at www.amanitrading.in

Place: AHMEDABAD Date: 13TH AUGUST, 2019

Place: Ahmedabad.

FOR AMANI TRADING AND EXPORTS LTD. (KEYUR J. PARIKH) CHAIRMAN

Place: AHMEDABAD

Date: 13TH AUGUST, 2019

NALIN LEASE FINANCE LIMITED

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of BSE Ltd. at www.bseindia.com and at www.aaswatrading.in

> CIN: L65910GJ1990PLC014516 Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264, email: nalinlease@yahoo.co.in www.nalinfin.co.in

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2019 (Rs.in Lacs)

SI. No.	PARTICULARS	F	For the quarter ended			
		30 June 2019	31 March 2019	30 June 2018	31 March 2019	
		Unaudited	Audited	Unaudited	Audited	
1.	Total Income From Operations	98.58	76.63	100.31	379.69	
2.	Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	66.54	39.33	40.30	175.57	
3.	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	66.54	39.33	40.30	175.57	
4.	Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)	47.73	27.01	29.95	128.13	
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	47.73	27.01	29.95	128.13	
6.	Paid up Equity Share Capital	326.20	326.20	326.20	326.20	
8.	Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-					
	1. Basic: 2. Diluted:	1.46 1.46	0.83 0.83	0.92 0.92	3.93 3.93	

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Reguirements) Regulations, 2015 The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) & Company's website (www.nalinfin.co.in)

For, NALIN LEASE FINANCE LTD Sd/- (D.N.Gandhi) Place : Himatnagar Managing Director Date : 13-08-2019

INDUSTRIES

CIN: L91110GJ1988PLC010674

Regd Office: 19/20/21 Third Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad – 380 009

Email: ail@amrapali.com Website: www.amrapalispot.com

STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR

THE QUARTER ENDED ON JUNE 30, 2019						
		(Rs. in Lak	h except EPS)			
PARTICULARS	Quarter ended 30-06-2019 Unaudited	Quarter ended 30-06-2018 Unaudited	Year ended 31-03-2019 Audited			
Total Income From Operations (net)	5,45,324.14	2,85,862.62	14,09,321.76			
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	2.28	30.62	(39.14)			
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	2.28	30.62	(39.14)			
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	5.86	30.62	(6.59)			
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5.86	30.62	(6.59)			
Equity Share Capital	2,570.53	2,570.53	2,570.53			
Reserves (excluding Revaluation Reserve as shown in the audited Balance Sheet of the previous year)			161.20			
Earnings Per Share (of Rs. 5/- each) (for continuing and discontinued operations) (not annualised for quarter ended)						
Basic	0.01	0.06	(0.01)			
Diluted	0.01	0.06	(0.01)			

The above results were reviewed by the Audit commttee and subsequently taken on record by the Board of Directors of the company at its meeting held on August 13, 2019. The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the BSE Ltd.. The full format of the quarterly Financial Results are available on the BSE Ltd Website at www.bseindia.com and on the website of the Company at www.amrapalispot.com.

YASHWANT THAKKAR

(Managing Director) DIN - 00071126

For, AMRAPALI INDUSTRIES LTD

Gujarat Water Supply & Sewerage Board Tender Notice No. 14 of 2019-2020

Executive Engineer, Public Health Mechanical Division, 2nd Floor, Jalbhavan, Ellis Bridge, Ahmedabad invites tenders by E-tendering process from experienced contractors and qualifying bidders as per technical & financial criteria mentioned in tender for following type of works. Last date of on-line submission of tender: 30.08.2019 up to 18.00 Hr. The detailed tender notice & tender documents are available on website: www.nprocure.com. and www.statetenders.com. Superintending Engineer, Public Health Mechanical Circle, Abmedabad reserves the right to reject any or all tenders without assigning any reason.

Ahn	Ahmedabad reserves the right to reject any or all tenders without assigning any reason.							
Sr. No.	Details of Works	1. Estimated cost Rs. 2. EMD amount Rs. 3. Tender Fees Rs.	Tender ID No.					
1	Construction of 13 Nos. Mini Water Supply Schemes with materials on existing bores at various villages of Nadiad, Mahudha & Mahemdavad taluka Dist. Kheda (Group No.1 & 2)	(1) 43,22,040.00 (2) 43,250.00 (3) 1500.00	372507					
2	Construction of 10 Nos. Mini Water Supply Schemes with materials on existing bores at various villages of Mahudha taluka, Dist: Kheda (Group No. 3)	(1) 33,32,339.00 (2) 33,300.00 (3) 1500.00	372509					
3	Construction of 10 Nos. Mini Water Supply Schemes with materials on existing bores at various villages of Nadiad taluka, Dist: Kheda (Group No. 4)	(1) 34,08,557.00 (2) 34,600.00 (3) 1500.00	372510					
4	Construction of 08 Nos. Mini Water Supply Schemes with materials on existing bores at various villages of Nadiad & Mahemdavad taluka, Dist. Kheda (Group No. 5)	(1) 26,58,371.00 (2) 26,600.00 (3) 1500.00	372511					
5	Construction of 11 Nos. Mini Water Supply Schemes with materials on existing bores at various villages of Nadiad, Kheda & Matar taluka, Dist. Kheda (Group No. 6)	(1) 36,58,073.00 (2) 36,600.00 (3) 1500.00	372512					
Co	Contact toll free Nu. 1916 for problem of Rural Water Supply Scheme.							

No.INF/ABD/741/2019-20



Gujarat Water Supply & Sewerage Board Tender Notice No. 13 of 2019-2020

executive Engineer, Public Health Mechanical Division, 2nd Flooi Jalbhavan, Ellis Bridge, Ahmedabad invites tenders by E tendering process from experienced contractors and qualifying bidders as per technical & financial criteria mentioned in tender for following type of works. Last date of on-line submission of tender: 30.08.2019 up to 18.00 Hr. The detailed tender notice & tender documents are available on website: www.nprocure.com. and www.statetenders.com. Superintending Engineer, Public Health Mechanical Circle, Ahmedabad reserves the right to reject any or all tenders without assigning

any reason.						
Sr. No.	Details of Works	1. Estimated cost Rs. 2. EMD amount Rs. 3. Tender Fees Rs.	Tender ID No.			
1	Construction of 10 Nos. Mini Water Supply Schemes with materials on existing bores at various villages of Petlad, Borsad & Sojitra taluka, Dist: Anand (Group No.1)	(1) 34,61,484.00 (2) 34,615.00 (3) 1500.00	372463			
2	Construction of 14 Nos. Mini Water Supply Schemes with materials on existing bores at various villages of Anklav, Petlad, Borsad, Anand & Umreth, Dist. Anand (Group No. 2, 3 & 6)	(1) 48,11,077.00 (2) 48,111.00 (3) 1500.00	372499			
3	Construction of 14 Nos. Mini Water Supply Schemes with materials on existing bores f at various villages o Anklav & Borsad taluka, Dist: Anand (Group No. 4 & 7)	(1) 48,11,077.00 (2) 48,111.00 (3) 1500.00	372504			
4	Construction of 09 Nos. Mini Water Supply Schemes with materials on existing bores at various villages of Khambhat, Anand, Umreth, Petlad & Borsad taluka. Dist: Anand (Group No. 5)		372505			

Contact toll free Nu. 1916 for problem of Rural Water Supply Scheme.

No.INF/ABD/740/2019-20

REAL ECO-ENERGY LIMITED
(Formerly Real News & Views Limited)
Regd. Office: 4th Floor, "KARM" Corporate House, Opp. Vikramnagar, Nr. Newyork Timber Mart, Ambli Bopal Road, Ahmedabad - 380059, Gujarat. • CIN: L74110GJ1993PLC019930

STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2019 (Rs. in Lakhs)

Particulars	Quarter Ending	Year to date Figures	Corresponding 3 months ended in the previous year		
	30/06/2019	31/03/2019	30/06/2018		
	Unaudited	Audited	Unaudited		
Total income from operations	0.00	297.08	0.00		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(25.58)	(164.39)	(61.16)		
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(25.58)	(164.39)	(61.16)		
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(52.32)	(151.56)	(57.98)		
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(52.32)	(151.56)	(57.98)		
Equity Share Capital	2000.00	2000.00	2000.00		
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)					
Basic :	(0.26)	(0.76)	(0.29)		
Diluted:	(0.26)	(0.76)	(0.29)		
Earnings Per Share (after extraordinary items) (of Rs.10/- each) (not annualised)					
Basic:	(0.26)	(0.76)	(0.29)		
Diluted :	(0.26)	(0.76)	(0.29)		
NOTES: The above is an extract of the detailed format of Quarterly Financial Posults					

NOTES: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange Website (www.bseindia.com) and the Company's Website (http://www.realecoenergy.in/)

BHAVNA N. AYER (Director) DIN: 02013477

For, REAL ECO-ENERGY LIMITED

૧૫મી ઓગષ્ટ અને રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ



(પ્રતિનિધિ) ભરૂચ

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે આગામ ૧૫મી ઓગષ્ટ અને રક્ષાબંધન તહેવાર ને અનુલક્ષી ને સ્ટેશન વિસ્તાર માં આરપીએફ ની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૫મી ઓગષ્ટ અને રક્ષાબંધન ના તહેવાર અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.અંકલેશ્વર આરપીએફ ના પી.આઈ સંજીવ પાંડે એ સ્ટાફ સાથે પ્લેટફોર્મ,મુસાફરો ની બેગ,પાર્સલ તેમજ સ્ટોલ અને ટીકીટ બારી પાસે સઘન ચેકીંગ હાથ ધરવા સાથે વાહન પાંકિંગ માં પણ પાર્ક કરેલ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ.સાથે સાથે વાહન પાંકિંગ સંચાલકો ને પણ વાહનો ની સ્લીપ અંગે સૂચનાઓ આપી હતી. જો કે ચેકીંગ દરમ્યાન કઈ વાંધાજનક મળી આવ્યું ન હતું.પરંતુ આગામી દિવસો માં પણ આ રીતે સતર્ક રહી ચેકીંગ ચાલુ રાખવામાં આવનાર છે. ★

મોડાસા ટાઉનના લાંચીયા પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટની ધરપકડ :૫ દિવસના રિમાન્ડ મંજ્ર

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮ માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા ત્યારે દુષ્કર્મ ના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેમાંથી ર લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કેર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબી નો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોકડી નજીક ગાંધીનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી ફરિયાદી પાસેથી પીએસઆઈ કે.ડી. બ્રહ્મભક્ર ૨૦ હજાર રૂપિયાની લાંચ લીધી હતી એસીબીની ટ્રેપની ગંધ આવી જતા લાંચના ૨૦ હજાર રૂપિયા લઈ રફૂચક્કર થઈ જતા નોસતા ફરતા પીએસઆઈને ઝડપી લેવા એસીબીની ટીમે સંભવિત સ્થળોએ રેડ પાડવાની સાથે રાજ્યના તમામ પોલીસ મથકોમાં જાણ કરવામાં આવી હતી. મોડાસા ટાઉન લાંચીયો

કે.ડી.બ્રહ્મભટ્ટ ૪ દિવસ ભૂગર્ભ માં

રહ્યા પછી શનિવારે રાત્રે સામેથી

ગાંધીનગર એસીબી ઓફિસમાં

હાજર થઈ જતા ગાંધીનગર એસીબી

ટીમના તપાસ અધિકારી આર.એન

પટેલ અને તેમની ટીમે પીએસઆઈને

પીએ સઆઈ

રવિવારે ગાંધીનગર થી લઈ આવી મોડાસા સેસન્સ કોર્ટના જજ આગળ રજુ કરતા પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટના પ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા ગાંધીનગર એસીબીની ટીમે ૫ દિવસના રિમાન્ડ મૃંજુર થતા આગળની કાર્યવાહી હાથધરી હતી. ★

જામનગર-તીરુનલવેલી તથા હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનોમાં અસ્થાઇ ધોરણે લાગશે વધારાનો એક 3 એસી કોચ

યાત્રિયો ની સુવિધા અને વધુ પડતી ભીડ ને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ રેલ્વે ડિવિઝન ની બે જોડી ટ્રેનોમાં ઓગષ્ટ, ૨૦૧૯ માં અસ્થાઇ ધોરણે વધારાના ૩ એસી કોચ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોડવામાં આવેલ વધારાના કોચની વિગત નીચે મુજબ છે. ૧. ૧૯૫૭૮/ ૧૯૫૭૭ જૉમનગર-તીરુનલવેલી એક્સપ્રેસ માં તાત્કાલીલ પ્રભાવ થી ૩૧ ઓગષ્ટ સુધી જામનગર થઈ તથા ૧૨ ઓગષ્ટ થી ૦૨ સપ્ટેમ્બર સુધી તીરુનલવેલી થી એક ૩ એસી કોંચ જોડવામાં આવશે. ૨. ૨૨૯૦૮/ ર ૨૯૦૭ હાપા-મડગાંવ એક્સપ્રેસ માં ૧૫ ઓગષ્ટ થી ૨૯ ઓગષ્ટ સુધી હાપા થી તથા ૧૬ ઓગષ્ટ થી ૩૦ ઓગષ્ટ સુધી મડગાંવ થી એક ૩ એસી કોચ જોડવામાં આવશે.

ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ તરીકે સરોંડાના સરપંચ નરોત્તમ પટેલની વરણી

પીએસઆઈ

(प्रतिनिधि) वससाड,

ઉમરગામ તા ૧૨ ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ તરીકે સરોંડાના સરપંચ નરોત્તમ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સરપંચોની સમસ્યા



તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ સોનપાલ અને મહામન્ત્રી મુકેશભાઈ પટેલ વિગેરે ની ઉપસ્થિતિમાં મંત્રી રમણભાઈ પાટકર ના ધરે મળેલી બેઠકમાં સરોંડાના સરપંચ પત્રકાર એવા નરોત્તમભાઇ પટેલને ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ તરીકે વરણી કરવાનું નક્કી કર્યું હતું. બહુદા સરપંચોએ આ બાબતે પોતાનું સમર્થન આપી ખુશી વ્યક્ત કરી છે. ★

<u>નામ બદલેલ છે</u> મેં મારૂ જુનું નામ **ડભોઈવાલા** રીઝવાનાફાતેમા ઈમરાન હતું તે બદલીને શેખ રીઝવાનાબાનુ **ઇમરાન** રાખેલ છે.

સરનામું : ૪૭૦૭, ખાટકીવાડ,

જમાલપુર અમદાવાદ

લેસ્ટર્ન ટાઇમ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

REAL ECO-ENERGY LIMITED

(Formerly Real News & Views Limited)

Regd. Office: 4th Floor, "KARM" Corporate House, Opp. Vikramnagar, Nr. Newyork Timber Mart, Ambli Bopal Road, Ahmedabad - 380059, Gujarat. • CIN: L74110GJ1993PLC019930

dujatat. • GIN. L74110031993FLG019930						
STANDALONE UNAUDITED FIN						
QUARTER ENDED	JUNE 30	, 2019 (F	Rs. in Lakhs)			
Particulars	Quarter Ending	Year to date Figures	Corresponding 3 months ended in the previous year			
	30/06/2019	31/03/2019	30/06/2018			
	Unaudited	Audited	Unaudited			
Total income from operations	0.00	297.08	0.00			
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(25.58)	(164.39)	(61.16)			
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(25.58)	(164.39)	(61.16)			
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(52.32)	(151.56)	(57.98)			
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(52.32)	(151.56)	(57.98)			
Equity Share Capital	2000.00	2000.00	2000.00			
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)						
Basic:	(0.26)	(0.76)	(0.29)			
Diluted:	(0.26)	(0.76)	(0.29)			
Earnings Per Share (after extraordinary items) (of Rs.10/- each) (not annualised)						
Basic:	(0.26)	(0.76)	(0.29)			
Diluted :	(0.26)	(0.76)	(0.29)			

NOTES: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange Website (www.bseindia.com and the Company's Website (http://www.realecoenergy.in/)

For, REAL ECO-ENERGY LIMITED SD/-BHAVNA N. AYER (Director) DIN: 02013477 કોરલ લેબોરેટરીઝ લિમિટેડ

નોંધણીકૃત કાર્યાલયઃ એસ એક–૨૦૬, સિલ્પર એક કોમ્પ્લેક્સ, બી.પી.સી. રોક, વકોદરા – ૩૯૦૦૨૦. ફોન ઃ ૦૨૨–૨૫૦૦૫૨૪૫/૪૬ ફેક્સ ઃ ૦૨૨–૨૫૦૦૪૮૯૩ વેબસાઇટ ઃ www.corallab.com ઇમેલ ઃ cs@corallab.com કોર્પોરેટ કાર્ચાલયઃ ૩/બી, પાટણવાલા કમ્પાઉન્ડ, શ્રેયસ સિનેમાની સામે, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (પશ્ચિમ) મુંબઈ – ૪૦૦૦૮૬

CIN: L24231GJ1997PLC031669 ૩૦ જૂન, ૨૦૧૯ના રોજ પૂર્ણ થયેલાં ત્રિમાસિકગાળા માટે ઑડિટ થયાં વિનાના સ્ટેન્ડએલોન **ചാവടില വട്ടാവചി**ച്ച ചാല്ല

ના વાકાય વારણામાના સારાય રુ. લાખમા (ઇપોએસના આકડા					
ક્રમ ન.	વિગતો		ર્ગ થયેલો ત્રિમાસિક ગ		પૂર્ણ થયેલ વર્ષ
σ.		૩૦.૦૬.૨૦૧૯ (ઑડિટ નહીં થચેલ)	૩૦.૦૬.૨૦૧૮ (ઑડિટ નહીં થચેલ)	૩૧.૦૩.૨૦૧૯ (ઑડિટ થચેલ)	
٩	સંચાલનમાંથી પ્રાપ્ત થયેલી કુલ (ચોખ્ખી) આવક	૧૪૪૪.૫૭	૨૩૫૩.૯૮	૨૦૨૫.૦૩	૯ ૬૨૩.૬૨
ચ	અહીં જણાવેલ સમયગાળાનો ઓખ્ખો નફો /(ખોટ) (કર, અપવાદરુપ અને/અથવા અસાઘારણ ચીજો પહેલાં)	પ૧.∈૬	૫૧૫.૪૮	-8.20	१૫५०.५५
3	કરની ચૂકવણી પહેલાંના સમયગાળાનો ચોખ્ખો નફો / (ખોટ) (અપવાદરુપ અને/અથવા અસાધારણ ચીજો પછી)	પ૧.∈૬	૫૧૫.૪૮	− ∀.∠૭	१૫५०.५५
8	કર ચૂકવ્યાં પછીના સમયગાળાનો ચોખ્ખો નફો / (ખોટ) (અપવાદરુપ અને /અથવા અસાધારણ ચીજો પછી)	3∠.∈9	393.⊖∠	-30.39	1021.55
ч	અહીં જણાવેલ સમયગાળાની કુલ સર્વગ્રાહી આવક જેમાં અહીં જણાવેલ સમયગાળા (કર ચૂકવ્યાં પછી) માટેના નફા / (ખોટ.) અને અન્ય કુલ સર્વગ્રાહી આવક (કર ચૂકવ્યાં પછી)નો સમાવેશ થાય છે.	- ૧૨૨.૧	- ૪૧૯.૩૭	કક	-900.53
9	ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડી	૩૫૭.૨૬	૩૫૭.૨૬	૩૫૭.૨૬	૩૫૭.૨૬
O	ગત વર્ષના સરવૈયામાં દર્શાવ્યાં મુજબની અનામત મૂડી (પુનઃમૂલ્યાંકનની અનામત મૂડી સિવાય)	0	0	0	9909€.0
2	ચોખ્ખું મૂલ્ચ	0	0	0	99309.69
E	શેર દિ.દ (પ્રત્યેક રુ. ૧૦/ –નો) કમાણી (ચાલી રહેલા અને બંધ થઈ ગયેલા સંચાલનો માટે) –				
	૧. મૂળભૂતઃ	9.0∈	90.9€	-0.24	२८.५
	૨. ઘટાકેલઃ	9.0∈	90.9€	-0.24	२८.५

તારીખઃ ૧૨ ઑગસ્ટ, ૨૦૧૯

૧ અહીં ઉપર સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિક્વાર્યમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના નિયમ ૩૩ हેઠળ ૧૨ ઑગસ્ટ, ૨૦૧૯ના રોજ સ્ટોક એક્સચેન્જમાં જમા કરાવવામાં આવેલ ત્રિમાસિકગાળા અને ૩૦ જૂન, ૨૦૧૯ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષના ઑડિટ નહીં થયેલાં સ્ટેન્ડએલોન નાણાકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો સારાંશ આપવામાં આવ્યો છે. ઑડિટ થયેલાં સ્ટેન્ડ્એલોન નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ (www.bseindia.com) અને કંપનીની વેબસાઈટ (www.corallab.com) પર ઉપલબ્ધ છે. કંપનીએ ૧ એપ્રિલ, ૨૦૧૭થી શરુ થઈ રહેલાં નાણાકીય વર્ષ માટે Ind ASને અપનાવેલ છે. અને ઉપરોક્ત પરિણામો કંપનીઝ

(એકાઉન્ટિંગ સ્ટાર્ન્ડક્ર્ઝ) રુલ, ૨૦૧૫ના નિયમ ૩ની સાથે વંચાતી કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૩૩ ફેઠળ તૈયાર . કેરવામાં આવેલ Ind AS અર્નુસાર તૈયાર કરવામાં આવેલ છે.

3 ઑડિટ કમિટી દ્વારા ઉપરોક્ત નાણાકીય પરિણામોની સમીક્ષા દાથ ધરવામાં આવી હતી અને ૧૨ ઑગસ્ટ, ૨૦૧૯ના રોજ યોજવામાં આવેલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગમાં તેને મંજૂર કરવામાં આવ્યાં હતાં.

કોરલ લેબોરેટરીઝ લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર માટે અને તેમના વતી

(Rs. In Lakhs, except per share data)

(0.35)

(0.17)

શ્રી ગિરીશ ધામેજા પૂર્ણકાલિક નિદેશક (DIN:07798455)

RR METALMAKERS INDIA LIMITED (FORMERLY KNOWN AS SHREE SURGOVIND TRADELINK LIMITED)
CIN No L51901GJ1995PLC027958

Extr	<u>ract of Statement of Standalone and Consolidated Unau</u>	<u>dited Financial I</u>	Results for the C	<u>)uarter ended Ju</u>	<u>ine 30, 2019 F</u>	Rs. in Lakhs (Except EPS)		
		Stan	dalone Resu	ılts	Consc	Consolidated Resul			
		Quarter	s Ended	Years Ended	Quarter	Quarters Ended			
Sr.	Particulars	30-Jun-2019	30-Jun-2018	31-Mar-2019	30-Jun-2019	30-Jun-2018	31-Mar-2019		
No.	T ditticulars	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited		
1	Total Income from operations	2,883.23	2,718.65	12,809.67	2,899.59	2,779.06	12,963.57		
2	Net Profit / (Loss) for the period (before Tax,	(170.31)	17.76	110.21	(169.64)	18.87	100.83		
	Exceptional and/or Extraordinary items)								
3	Net Profit / (Loss) for the period before tax	(170.31)	17.76	110.21	(169.64)	18.87	100.83		
	(after Exceptional and/or Extraordinary items)								
4	Net Profit / (Loss) for the period after tax	(169.96)	12.27	83.54	(169.79)	13.04	74.39		
	(after Exceptional and/or Extraordinary items)								
5	Total Comprehensive Income for the period	(169.96)	12.27	82.29	(169.79)	13.04	73.14		
	[Comprising Profit / (Loss) for the period (after tax)								
	and other Comprehensive Income (after tax)]								
6	Equity Share Capital	698.50	698.50	698.50	698.50	698.50			
7	Reserves (excluding revaluation reserve as shown	-	-	189.17	-	-	189.17		
	in the balance sheet)								
8	Earnings Per Share (of Rs. 10/- each)								
9	Basic	(2.43)	0.18		(2.43)	0.19	1.08		
	Diluted	(2.43)	0.18	1.20	(2.43)	0.19	1.06		
Not	te:								

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e., www.bseindia.com and Company's webiste i.e., www.rrmetalmakers.com

The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held o The above results are in accordance with the Indian Accounting Standards(IND-AS) as prescribed under section 133 of the Companies

period's figures have been reclassified / regrouped / restated wherever necessary By order of the Board of Directors For RR Metalmakers India Limited

Mumbai, August 13, 2019

(Formerly known as Shree Surgovind Tradelink Limited)

Virat S Shah - Chairman, DIN- 00764118

AMANI TRADING AND EXPORTS LIMITED

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2019

Regd. Office: 32, Milanpark Society, Nr. Jawahar Chowk, Maninagar, Ahmedabad - 380 008. CIN: L51100GJ1984PLC020026 E-mail: amaniexports@yahoo.co.in Tel.No.: 079-25462907

Unaudited Audited Unaudited **Particulars** Quarter ended Year ended Quarter ended 6/30/2019 3/31/2019 6/30/2018 Total Income from Operations 2.73 224.31 2.74 Net Profit/(Loss) for the period before tax and Exceptional items 0.24 (1.41)(0.90)Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or 0.24 (1.41)(0.90)Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or (0.03)(1.21)(2.45)Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) (0.03)(2.45)(1.21)for the period (after tax) and Other Comprehensive Income (after tax)] **Equity Share Capital** 69.97 69.97 69.97 Earnings per share [EPS] (of Rs.10/- each) (not annualised) Basic and diluted EPS before Exceptional items [in Rs.] (0.01)(0.35)(0.17)

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange unde Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of BSE Ltd. at www.bseindia.com and at www.amanitrading.in

(0.01)

Basic and diluted EPS after Exceptional items [in Rs.]

FOR AMANI TRADING AND EXPORTS LTD. Place: AHMEDABAD (KEYUR J. PARIKH) Date: 13TH AUGUST, 2019 **CHAIRMAN**

CIN: L91110GJ1988PLC010674

Regd Office: 19/20/21 Third Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad – 380 009

Phone: +91-79-26581329/30, +91-79-26575105/06 Fax: +91-79-26579169/26584313 Email: ail@amrapali.com Website: www.amrapalispot.com

STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2019

(Rs. in Lakh except EPS)						
PARTICULARS	Quarter ended 30-06-2019 Unaudited	Quarter ended 30-06-2018 Unaudited	Year ended 31-03-2019 Audited			
Total Income From Operations (net)	5,45,324.14	2,85,862.62	14,09,321.76			
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	2.28	30.62	(39.14)			
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	2.28	30.62	(39.14)			
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	5.86	30.62	(6.59)			
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5.86	30.62	(6.59)			
Equity Share Capital	2,570.53	2,570.53	2,570.53			
Reserves (excluding Revaluation Reserve as shown in the audited Balance Sheet of the previous year)			161.20			
Earnings Per Share (of Rs. 5/- each) (for continuing and discontinued operations) (not annualised for quarter ended)						
Basic	0.01	0.06	(0.01)			
Diluted	0.01	0.06	(0.01)			
Note:						

The above results were reviewed by the Audit commttee and subsequently taken on record by the Board of Directors of the company at its meeting held on August 13, 2019. The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the BSE Ltd.. The full format of the quarterly Financial Results are available on the BSE Ltd Website at www.bseindia.com and on the website of the Company at www.amrapalispot.com.

Place: Ahmedabad

Date : August 13, 2019

For, AMRAPALI INDUSTRIES LTD YASHWANT THAKKAR (Managing Director) DIN - 00071126

એમ્બિશન માઈકા લીમીટેડ

CIN: L25202Wh2010PLC059931

૨જીસ્ટર્ડ ઓફિસઃ ૬૧૫-૬૧૯, છઠ્ઠો માળ, શિવમ આર્કેડ, સાતવ-૧ પાસે, હંસપુરા, નરોડા, દહેગામ રોડ, નરોડા, અમદાવાદ-૩૮૨૩૩૦ ફોને નં.૦૭૯-૨૯૨૯૨૬૨૯,વેબસાઇટ : www.ambitionmica.com, ઇમેઇલ:investor@ambitionmica.com ૩૦મી જૂન, ૨૦૧૯ના રોજ પૂરા થતા ત્રીમાસિક(સ્ટેન્ડલોન) ઓડિટેડ નાંણાકીય પરિણામો

(३।५व।							
ક્રમ નં.	વિગતો			ત્રિમાસિક ગાળાના અંતે ૩૦.૦૬.૨૦૧૮			
9	કામગીરીમાંથી કુલ આવક	1८૯૫.८૯	1920.21	રદ્દપદ.પર	८३६४.६७		
	નફો/(નુકશાન) સમયગાળો માટે						
3	(કરવેરા અને અસાધારણ વસ્તુઓ પહેલાં) નફો / (નુકશાન) ગાળાના સમયગાળો	(८०.४७)	3६६.४४	130.80	૧૪૭.૨૮		
3	ત્રફા / (તુકશાન) ગાળાના સમયગાળા (કરવેરા પહેલા અને અસાધારણ વસ્તુઓ પછી)	(68.05)	355.88	130.80	૧૪૭.૨૮		
४	ચોખ્ખો નફો / (નુકશાન) ગાળાના સમયગાળો ´						
પ	(કરવેરા બાદ અને અસાધારણ વસ્તુઓ) પેઇડ અપ ઇક્વિટી શેર મુડી	(८४.३०)	૩૫૦.૦૨	૯૫.૫૫	૧૧૬.૬૨		
	(રૂ.૧૦/ - પ્રતિ શેરનું ફેસ વેલ્યુ)	૧૪૯૨.૨૦	૧૪૯૨.૨૦	૧૪૯૨.૨૦	૧૪૯૨.૨૦		
	એનામત (પુનઃ મૂલ્યાંકન અનામત બાદ કરતા)	૧૩૮૭.૯૨	૧૪૭૧.૭૩	૧૪૫૦.૫૩	૧૪૭૧.૭૩		
9	શેર દીઠ કમાણી						
	-બેઝિક્	(૦.૫૬)	ર.૩૫	0.58	0.92		
	-ડાયલ્યુટેડ	(૦.૫૬)	ર.૩૫	0.58	0.92		

નોંદા : કંપનીના ત્રીમાસિક નાણાંકીય હિસાબોનું ફુલ ફોર્મેટ સેબીના સ્ટોક એક્સચેઇન્જમાં (લીસ્ટીંગ ઓબ્લીગેશન અને ડીસ્ક્લોઝર રીક્વાયરમેન્ટ) રેગ્યુલેશન ૩૩, ૨૦૧૫ મુજબ. ત્રીમાસિક નાણાકીય હિસાબીનું ફુલ ફોર્મેટ સ્ટોક એક્સચેઇન્જની વેબસાઇટ www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.ambitionmica.com પર ઉપલબ્ધ છે.

તારીખ : ૧૩.૦૮.૨૦૧૯

મેનેજાંગ ડાયરેક્ટર ડીન : ૦૨૯૨७૧૬૫

ROYALE MANOR HOTELS AND INDUSTRIES LIMITED

CIN: L55100GJ1991PLC015839

Regd. Office: International Airport Circle, Ahmedabad 382475, Web: www.rmhil.com, email: royalemanorehotels@rediffmail.com, Telephone: 079-22868642/43 Telefax: 079-22868641

	Extract of Standalone Unaudited Financial Results for the Quarter ended 30th June, 2019				
				(₹ in Lakhs)	
Sr. No.	Particulars	Quarter Ended 30/06/2019 (Unaudited)	Year Ended 31/03/2019 (Audited)	Quarter Ended 30/06/2018 (Unaudited)	
1	Total income from operations (net)	508.85	2393.03	456.61	
2	Net Profit / (Loss) for the period (before Exceptional Item, Extraordinary items & tax)	38.46	412.68	12.59	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional Item, Extraordinary items)	38.46	412.68	12.59	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional Item, Extraordinary items)	30.46	330.35	9.99	
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive				
	Income(after tax)	30.46	330.35	9.99	
6	Equity Share Capital	1693.22	1693.22	1693.22	
7	Reserves (excluding Revaluation	2430.80	2430.80	2100.46	
	Reserve as shown in the Balance Sheet of previous year)	(as on 31.03.2019)	(as on 31.03.2019)	(as on 31.03.2018)	
8	Earnings Per Share (Rs. 10/-each) (not annualized)				
	Basic: (Rs)	0.18	1.95	0.06	

Diluted (Rs.)

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com and on company's website www.rmhil.com
- The above results were reviewed by the Audit Committee & thereafter approved by the Board of Directors at its meeting held on August 13, 2019. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.

The Previous quarter's figures have been regrouped and/or rearranged, wherever considered necessary.

By Order of the Board For Royale Manor Hotels and Industries Limited

0.18

1.95

0.06

Ummed Singh Champawat Chairman & Managing Director Ahmedabad

August 13, 2019

AASWA TRADING AND EXPORTS LIMITED

Reg. Office: 32, Milanpark Society, Near Jawahar Chowk, Maninagar, Ahmedabad - 380 008 CIN: L51100GJ1984PLC024704 E mail: aaswaexports@yahoo.co.in Tel.No.: 079-25462907

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2019

(Rs.in Lacs, except per share data)

Sr. No.		Unaudited	Audited	Unaudited		
	Particulars	Quarter ended 6/30/2019	Year ended 3/31/2019	Quarter ended 6/30/2018		
1	Total Income from Operations	2.80	386.11	2.62		
2	Net Profit/(Loss) for the period before tax and Exceptional items	0.37	11.47	0.32		
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.37	11.47	0.32		
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.30	11.47	0.24		
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	0.30	11.47	0.24		
6	Equity Share Capital	72.00	72.00	72.00		
7	Earnings per share [EPS] (of Rs.10/- each) (not annualised)					
	Basic and diluted EPS before Exceptional items [in Rs.]	0.04	1.59	0.03		
	Basic and diluted EPS after Exceptional items [in Rs.]	0.04	1.59	0.03		
Mote	Note: The above is an extract of the detailed format of Quarterly/Angual Financial Deculte filed with the Stock Evenance under					

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of BSE Ltd. at www.bseindia.com and at www.aaswatrading.in

Place : AHMEDABAD Date: 13TH AUGUST, 2019

Place: Himatnagai

Date: 13-08-2019

FOR AASWA TRADING AND EXPORTS LTD. (KEYUR J. PARIKH) CHAIRMAN



NALIN LEASE FINANCE LIMITED CIN: L65910GJ1990PLC014516

Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264, email: nalinlease@yahoo.co.in www.nalinfin.co.in

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2019 (Rs.in Lacs)

SI. No.	PARTICULARS	ı	For the year ended		
		30 June 2019	31 March 2019	30 June 2018	31 March 2019
		Unaudited	Audited	Unaudited	Audited
1.	Total Income From Operations	98.58	76.63	100.31	379.69
2.	Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	66.54	39.33	40.30	175.57
3.	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	66.54	39.33	40.30	175.57
4.	Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)	47.73	27.01	29.95	128.13
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after Tax) and Other	47.73	07.04	00.05	400.40
6	Comprehensive Income (after tax)	326.20	27.01 326.20	29.95 326.20	128.13 326.20
6. 8.	Paid up Equity Share Capital Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-	326.20	326.20	326.20	320.20
	1. Basic: 2. Diluted:	1.46 1.46	0.83 0.83	0.92 0.92	3.93 3.93

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Regulation Regulations, 2015 The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) &

For, NALIN LEASE FINANCE LTD Sd/- (D.N.Gandhi) Managing Director